



કરોવીનિ  
E S I C

# કોવિડ-19 ઉદ્યોગ તેમજ સંસ્થાઓ માટે માર્ગદર્શિકા



શ્રમ અને રોજગાર મંત્રાલય  
Ministry of Labour & Employment  
ભારત સરકાર (Government of India)  
Website: [www.labour.gov.in](http://www.labour.gov.in)



કર્મચારી રાજ્ય વીમા નિગામ  
Employees' State Insurance Corporation  
[www.esic.nic.in](http://www.esic.nic.in), [www.esic.in](http://www.esic.in)

## પ્રસ્તાવના

એવી સંભાવના છે કે કોરોના વાયરસ રોગ 2019 (કોવિડ-19) નજીકના ભવિષ્યમાં સમાજમાં ચથાવત રહેશે. એટલે વ્યવસાયો, શ્રમિકો અને ગ્રાહકો ઉપર કોવિડ-19ની અસરને ઓછી કરવા માટે યોજના બનાવવી મહત્વપૂર્ણ છે. આ માર્ગદર્શન, વ્યવસાયોને કાર્યસ્થળ ઉપર કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે યોજના બનાવવામાં મદદરૂપ થવાના ઉદ્દેશથી છે. વ્યવસાયિકો અને નિયોજકોને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાજ્ય સરકાર (ખાસ કરીને કન્ટેન્મેન્ટ ઓનની ઓળખ માટે), પીએચડી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એસોસિએટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા, ભારતીય વાહિજ્ય અને ઉદ્યોગ મહાસંધ, ભારતીય ઉદ્યોગ પરિસંધ અને નેશનલ એસોસિએશન ઑફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપની વગેરેની વેબસાઇટ્સ્થી અધ્યતન અને પ્રમાણિત માહિતી મેળવવી જોઈએ. કર્મચારીઓ અને ચુનિયન સાથે સહયોગ કરવો અગત્યનો છે, જેથી માત્ર કોવિડ-19ની મહત્વપૂર્ણ માહિતીનો અસરકારક રીતે પ્રસાર કરી શકાય. એટલું જ નહિ, પરંતુ જોખમની આકારાની અને સમાધાન શોધી શકાય.



આ સામાન્ય દિશાનિર્દેશોની મદદથી, જરૂર મુજબ, તેઓ એક અનુકૂળ યોજના ઘડશો, અમલ કરશો તથા સુધારા કરશો.

- જે વ્યાપાર અને તેના કાર્યસ્થળો અને પ્રક્રિયાઓ માટે વિશિષ્ટ છે
- જે કોવિડ-19ના સંભવિત જોખમ ધરાવતા તમામ ક્ષેત્રો અને કાર્યોની ઓળખ કરે છે.
- જેમાં, આ પ્રકારના જોખમને સમાઝ કરવા અથવા ઓછા કરવા માટે નિયંત્રણ ઉપાય શામેલ છે.
- જે શ્રમિકોની વર્ચે થતાં પ્રસારને રોકે છે અને ઓછો કરે છે.
- જે એક સુરક્ષિત વ્યવસાય સંચાલન અને એક સ્વસ્થ કાર્ય વાતાવરણને જાળવી રાખવામાં મદદ કરે છે.

# કોવિડ-19 વિશે

- કોવિડ-19 ધરાવતા દર્દીઓને સામાન્યતઃ તાવ, ઉધરસ, ગળામાં ખારાશ અને શરીરમાં દુઃખાવો રહેતો હોય છે, અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કેટલાક લોકો ગંધ અને સ્વાદ સંબંધિત પોતાની ઈજ્જ્વાળી ક્ષમતા ગુમાવી દે છે અથવા તેમને ઝાડા થઈશકે છે.
- ગંભીર બીમારી અને મૃત્યુનું જોખમ ઉમરની સાથે વધે છે. કોઈપણ ઉમરની વ્યક્તિ, જો તેને હાઈબલડ પ્રેશર, કેન્સર, ડાયાબિટીસ, હૃદય, કીડની કે ફેફસાંની બીમારી વગેરેથી પીડાતા હશે તો આ સ્થિતિમાં તેમને ગંભીર બીમારીનું જોખમ વધ્યું છે.
- કોવિડ-19 બહુ જ સરળતાથી પ્રસરે છે. જ્યારે એક સંકભિત વ્યક્તિ ઉધરસ ખાય, છીકે, હસે કે વાતચીત કરે ત્યારે વાયરસચુક્ત નાના-નાના છાંટા જેના કારણે કોવિડ-19 રોગ થાય છે, નજીક ઉભેલ કોઈપણ વ્યક્તિના મોં, નાક કે આંખો ઉપર પડે છે અને તે રોગગ્રસ્ત થઈ જાય છે. બે મીટરના અંતરમાં હાજર રહેલ વ્યક્તિઓને સૌથી વધુ જોખમ રહે છે. છાંટા આસપાસની સપાઠી અને વસ્તુઓ ઉપર પણ પડે છે; અને લોકો આવી દૂષિત સપાઠીકે વસ્તુઓનો સ્પર્શ કરી સંકભિત થઈશકે છે.
- વાયરસ ખૂબ જ સરળતાથી એવી જગ્યાએ પ્રસરે છે, જ્યાં લોકો ખૂબ જ ઓછી જગ્યામાં કે પછી પૂર્તી હવાની અવરજનાર વિનાના કોઈ એક ક્ષેત્રમાં સીમિત હોય.
- જે લોકો સંકભિત હોય છે, પરંતુ તેમનામાં કોઈ લક્ષણ જણાતા નથી, તેઓ પણ આ બિમારીને ફેલાવી શકે છે.

## લક્ષણ



તાવ



ઉધરસ



શ્વાસ લેવામાં  
તકલીફ



ગળામાં ખારાશ




માથાનો દુઃખાવો

# સામાન્ય નિયમ

કાર્ય સ્થળ ઉપર દરેક વ્યક્તિ (લક્ષણો હોય કે ના હોય) ને સંક્રમણાના સંભવિત ઓત સ્વરૂપે માનવા જોઈએ; અને તમામ યોજનાઓ આ ધ્યાનમાં રાખીને તૈયાર કરવી જોઈએ. વિવિધ કાર્ય સ્થળો અને તે જગ્યાએ કાર્યરત શ્રમિકો સાથે સંકળાયેલ તમામ જોખમી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જે આ મુજબ છે:

**૧.** કાર્ય સ્થળ ઉપર સંક્રમણાના ઓત, જેવાંકે:

- ક.** જાહેર જનતા, ગ્રાહક, સપ્લાયર અને શ્રમિક વગેરે.
- ખ.** બીમાર વ્યક્તિ અથવા તો ખાસ કરીને સંક્રમણનું સૌથી વધારે જોખમ ધરાવતા લોકો, દાખલા તરીકે, સ્વાસ્થ્ય કર્મચારી અને એવા મુસાફર, જે વ્યાપક કોવિડ-19 ના કેસ ધરાવતા સ્થળોની મુલાકાત લઈ ચુક્યા હોય.
- ૨.** કર્મચારી દ્વારા કરાયેલ કાર્ય.
- ૩.** ઘર અને સમાજમાં બિનવ્યાવસાયિક જોખમ ધરાવતા પરિબળો
- ૪.** ઉપર જાગાવ્યા અનુસાર ગંભીર બીમારી માટે શ્રમિકોના વ્યક્તિગત જોખમ પરિબળો
- ૫.** શ્રમિકની માનસિક સ્થિતિ.



# ਮੂਲਭੂਤ ਸੰਕਖਾਣਾ ਨਿਯੰਤਰਣ ਉਪਾਧ

**કોવિડ-19 ને રોકવા માટે તમામ પાંચ સાવધાનીઓનું પાલન કરો**

માસ્ક પહેરો	હાથ વારંવાર ધુઅં	શ્વસન શિષ્ટાચારનું પાલન કરો	સાભાજિક અંતર જળવો	કાર્યસ્થળને સતત સ્પર્શ અને ચોખ્ખું રાખો
-------------	---------------------	--------------------------------	----------------------	---

‘શ્રમિકોની સુરક્ષા’ વાતચીત, વિચાર-વિર્મશ, પણ્ણ-ઉત્તર, પોસ્ટરો, દ્રશ્ય-શાબ્દી સહાયક, પ્રતીક અને દ્રશ્ય સંકેત વગેરેની સહાયતાથી સંક્રમણ રોકવા માટે મૂળભૂત ઉપાયોનો આગ્રહ રાખવા અને મજબૂત કરવા ઉપર નિર્ભર રહેશે. કોવિડ-19 માટે મૂળભૂત સંક્રમણ નિયંત્રણ ઉપાયોમાં સમાવિષ્ટ છે:



1. કેમકે, આ રોગ મુખ્યત્વે ત્યારે ફેલાય છે, જ્યારે કોઈ દર્દી ઉધરસ ખાય, છિક્કિ, વાત કરે કે હસે. માટે એ મહત્વપૂર્ણ છે કે સાર્વજનિક સ્થળોમાં પ્રત્યેક વ્યક્તિ માસ્ક પહેરી પોતાનું મોં અને નાક ઢોકે. માસ્ક સતત પહેરેલું રાખવાનું છે અને તેને વ્યવસ્થિત રીતે પહેરવું તેમજ ઉતારવું જોઈએ.
  2. આ જ કારણથી શ્વસન શિષ્ટાચારનું પાલન થવું જોઈએ. આમાં, ખાંસી અને છીંકને હાથ, કોણીકે ટિશ્યુથી રોકવી જોઈએ, જેને પછી ઢાંકણાવાની કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ.
  3. ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી સતત અને સંપૂર્ણ રીતે હાથ ધોવાથી કે ઓછામાં ઓછા 60% ઇથાઈલ આલ્કોહોલ કે 70% આઇસોપ્રોપિલ આલ્કોહોલયુક્ત સેનીટાઇઝરથી હાથ સાફ કરવાથી દૂષિત સપાટીઓથી બીમારી થવાનું જોખમ ઓછું થઈ જશે. ઓછામાં ઓછા 40 સેકન્ડ માટે સાબુ અને પાણીથી હાથ ધોવા, તે સેનીટાઇઝરના ઉપયોગ કરતાં પણ વધારે અસરકારક છે.
  4. કોવિડ-19ના પ્રસારને મર્યાદિત કરવા લોકો વરચ્યે ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર એક સંભાવ્ય મહત્વપૂર્ણ કદમ છે. લોકો વરચ્યે 2 મીટરનું અંતર કોવિડ-19ના પ્રસારના જોખમને ઘટાડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પ્રત્યેક કાર્યકર્તાની આસપાસ ઓછામાં ઓછા 10 વર્ગ મીટર અંતરની ભલામણ કરે છે.
  5. વાયરસ, સામાન્યતા: ઉપયોગમાં લેવાતી સપાટીઓ ઉપર પણ હાજરી ધરાવતો હોઈ શકે છે, જે કોવિડ-19 અસરગ્રસ્ત દર્દી ઢ્ારા દૂષિત કરવામાં આવેલ હોઈ શકે છે. કોઈપણ કર્મચારી ઉપરોક્ત સંક્રમિત સપાટીને સ્પર્શ કરીને સંક્રમિત થઈ શકે છે. તાજું તૈયાર કરાયેલ 1% સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન કે 60% થી વધુ ઇથાઈલ આલ્કોહોલ સોલ્યુશન વાયરસને નષ્ટ કરે છે.
  6. લોકોને સુરક્ષિત રાખવા માટે માત્ર એક ઉપાય પૂરતો નથી. માસ્ક પહેરવો, સામાજિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને યોગ્ય તથા સતત સ્વચ્છતા, જ્યારે એક સાથે કરવામાં આવે છે, ત્યારે જ લોકો સરક્ષિત રહી શકે છે.

# કાર્યસ્થળ નિયંત્રણ

કાર્યસ્થળ વાતાવરણ માટે નિવારક ઉપાય

એન્જિનિયરિંગ નિયંત્રણ

પ્રશાસનિક નિયંત્રણ

કાર્યસ્થળ  
નિયંત્રણ

પીપીઇ

અમલીકરણાની સરળતા, અસરકારકતા અને ખર્ચ અંગે વિચાર કરતી વખતે પ્રત્યેક પ્રકારના નિયંત્રણ ઉપાયના ફાયદા તેમજ નુકશાન છે. આ ઉપાયોનું સંભિશ્રણ કર્મચારીઓને સુરક્ષિત રાહવા જરૂરી બની રહેશે. આ સામાન્ય માર્ગદર્શન છે અને આને વ્યવસાયની પ્રકૃતિ, તેના કાર્યસ્થળો, તેની પ્રક્રિયાઓ, તેના કર્મચારીઓ અને તેમના ઢ્રારા કરાયેલ કાર્યો મુજબ સાનુકૂળ કરવા જોઈએ.



કાચ/પ્લેક્સીલાસ/એકેલિક કેઅન્ય કોઈ ઉપલબ્ધ પાર્ટીશન જેવા ભૌતિક અવરોધ બેસાડવા.

## કાર્યસ્થળે હવા: મહત્વ બાબ્ધ હવાની અવરજન

- કાર્યસ્થળના એ.સી. માં બાબ્ધ હવાની અવરજન વધારવી તે માટે દરવાજા-બારીઓ ખોલવી કે એક્ઝોસ્ટ મુકાવવા.
- બિલ્ડિંગના ઉપયોગના સમયે  $1/2$  કલાક પહેલાં અને 2 કલાક પછી એક્ઝોસ્ટ/વેન્ટિલેશનના સાધનો ચાલુ કરવા.
- શૈચાલયમાં એક્ઝોસ્ટ ફેન ચોવીસ કલાક ચાલુ રાહવા.
- સેન્ટ્રલ એર કન્ડિશનિંગનો ઉપયોગ ટાળવો. ખૂબ જ જરૂરી લાગે ત્યારે હેપા (HEPA) ફિલ્ટર સાથે અલાયદા રૂમના એર કન્ડિશનરનો ઉપયોગ કરવો.
- એ બાબતે ખાતરી કરવી કે વેન્ટિલેશન સામગ્રી વ્યવસ્થિત કામ કરે છે અને પ્રત્યેક જગ્યાએ હાજર સભ્યો મુજબ સ્વીકાર્ય આંતરિક વાયુ ગુણવત્તા પૂરતા પ્રમાણમાં મળે છે.

એર કન્ડિશનિંગ અને વેન્ટિલેશનમાં ફેરફાર કરવા માટે કેન્દ્રિય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા પ્રકાશિત એચ્વીએસી માટેની વિસ્તૃત પુનરાવર્ત્તિ માર્ગદર્શિકાનો અભ્યાસ કરો.

## વહીવટી નિયંત્રણ

વહીવટી ફેરફારને અમલમાં મુકવા અપેક્ષાએ સરળ હોય છે અને તે કોવિડ-19ના પ્રસાર સંબંધિત જોખમો ઓછા કરવા સંદર્ભે દૂરોગામી હોય છે:

જો શક્ય હોય તો સંક્ષમણ નિયંત્રણ સંબંધિત કાર્ય કરવા માટે ટીમ બનાવો અથવા તો વ્યક્તિઓની ઓળખ કરો.

1. આંગતુકોનો ટાળો. માત્ર અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને આવનાર આંગતુકોને જ મળો. શક્ય હોય ત્યાં સુધી પ્રવેશ અગાઉ તેમનું આરોગ્ય સેતુ સ્ટેટ્સ તપાસી લેવું જોઈએ. સ્વાગત કક્ષથી આગળ કોઈપણ આંગતુકને પ્રવેશની મંજુરી આપવી નહીં.
2. બાયોમેટ્રિક હાજરી પદ્ધતિનો ઉપયોગ કરવો નહિં. ફિસ્કીંગ બંધ કરો.
3. તમામ કર્મચારીઓ અને આંગતુકોના તાપમાન માપવા માટે એકમના પ્રવેશદ્વાર ઉપર કેલિબ્રેટ, ઇન્ઝારેટ, સ્પર્શરહિત થર્મોમીટરનો ઉપયોગ કરો. કોવિડ-19ના લક્ષણો સંદર્ભે પૂછપરછ કરો. તાવકે લક્ષણો ધરાવતા તમામને ઘરે પરત જવા તેમજ તાત્કાલિક તબીબી સહાયતા મેળવવા સૂચન કરવું જોઈએ. આવનાર-જનારનું એક રજિસ્ટર બનાવો. ભીડથી બચવા એકથી વધુ જરૂરી પ્રવેશ અને સ્ક્રીનિંગની વ્યવસ્થા રાખવી.



4. કોવિડ-19ના લક્ષણોવાળા કર્મચારીઓને પોતાના સુપરવાઇઝરને સૂચિત કરવા અને ઘરે રહેવા તથા તબીબી સહાય મેળવવા પ્રોત્સાહિત કરવા. એવો સંદેશ પાઠવતા રહોકે હળવા લક્ષણ હોય તો પણ કર્મચારીઓએ ઘરે જ રહેવું જોઈએ. કર્મચારીઓને કોવિડ-19થી સંક્રમિત પરિવારના સભ્યોની સારસંભાળ કરવા અને સેલ્ફ મોનીટરીંગ કરવા ઘરે રહેવા મંજુરી આપો.
5. સુનિશ્ચિત કરો કે પ્રવેશ કરતાં અગાઉ તમામ કર્મચારી અને આંગતુક આલ્કોહોલ્યુક્ટ સેનિટાઇઝરથી પોતાના હાથ સાફ કરે.

### શ્વસન સ્વચ્છતા: માસ્ક ફરજિયાત; શ્વસન શિષ્ટાચાર જરૂરી

1. એવા આગ્રહ રાખો કે કર્મચારી અને આંગતુક પ્રવેશ પહેલાં અને એકમમાં હાજર હોવા દરમિયાન સતત માસ્ક પહેરો. તે ફરજિયાત કરાવો. કર્મચારીઓ માટે માસ્ક ખરીદો અથવા તેમને ત્રણ પડ ધરાવતા કાપડના માસ્ક સિવવા પ્રોત્સાહિત કરો; જેને સાબુ અને પાણીથી ધોચા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. કર્મચારીઓને ડેમો આપીને અથવા પોસ્ટર તેમજ ક્રશ્ય-શ્રાવ્ય સામગ્રી ઢ્રારા માસ્ક પહેરવા તથા ઉતારવાની સાચી રીત શીખવાડો.
2. શ્વસન શિષ્ટાચારને પ્રોત્સાહિત કરો અને કર્મચારીઓને બતાવો કે તે યોગ્ય રીતે કેમનું કરાય. કર્મચારીઓને અનુકૂળ સ્થળોએ ટિશુ પેપર અને ઢાંકણાવાળી કચરાપેટી ઉપલબ્ધ કરાવવી.



## કાર્યસ્થળ સ્વચ્છતા: સતત કાર્યસ્થળ સ્વચ્છતા જાળવી રાખો અને હાથ ધોતા રહો; કોઈ આપ-લે નાણી કે કોઈ સ્પર્શ નાણી.

- 1.** હાઉસકીપિંગ કામકાજ નિયમિત ધોરણે જાળવી રાખો, જેમાં તમામ માળ, વીજળીની સ્થિતો, પ્રવેશદ્વાર, રસોડું, શૌચાલયનું તમિયું, કાઉન્ટર્સ, નળ, સિન્ક અને શૌચાલય સીટ, મશીનરી, દરવાજા તથા બારીઓના હાથા તથા કડી, સીડીઓની રેલિંગ, વર્ક સ્ટેશન, ટેબલો તથા ડેસ્ક, ખુરશીઓ, વાહનો (ખાસ કરીને સંપર્ક સ્થાન) તથા વસ્તુઓ, જેવી કે ટેલિફોન તથા કમ્પ્યુટર કી-બોર્ડ વગેરે તથા કામકાજની જગ્યાના અન્ય વસ્તુઓની દિવસમાં ઓછામાં ઓછા બે વખત, પ્રત્યેક પાળી/શીફ્ટ અગાઉ એક વખત સફાઈતથા સંકમણાની અટકાયતનો સમાવેશ થાય છે. સંકમણ અટકાવવા માટે મહત્વ સ્પર્શ થનાર સપાટીઓની તપાસ ને પ્રાથમિકતા આપવી જોઈએ. સુનિશ્ચિત કરો કે સંપૂર્ણ સેનિટાઇડ કરવા પાળીઓ વચ્ચે એક કલાકનો ગાળો હોવો જોઈએ. 1% તાજો તૈયાર કરેલ સોડિયમ હાઇપોકલોરાઇટ સોલ્યુશન આ હેતુ માટે ઉપયોગમાં લઈશકાય છે. આલ્ઝોહોલ આધારિત સેનિટાઇડર એવી સપાટીઓ પર વાપરી શકાય, જે સોડિયમ હાઇપોકલોરાઇટથી સાફ ન કરી શકાય. કર્મચારીઓને તેમના કાર્યસ્થળોને સાફ કરવા સામગ્રી પૂરી પાડો. વિસંકામકનો સંગ્રહ અને ઉપયોગ લેબલ અનુસાર જવાબદારીપૂર્વક અને યોગ્ય રીતે કરવો. સરકાર માન્ય ઉર્ચય ગુણવત્તાયુક્ત સામગ્રીનો જ ઉપયોગ કરો.
- 2.** કચરા પેટી તથા તેની આજુબાજુની જગ્યાને દરરોજ દિવસના અંતે સાબુના સોલ્યુશનથી સાફ કરો તથા તાજાં બનાવેલ 1% સોડિયમ હાઇપોકલોરાઇટ સોલ્યુશનથી સંકમણ મુક્ત કરો. સુનિશ્ચિત કરો કે કચરાનો નિકાલ કરનાર દરેક વ્યક્તિ ગ્લોબ્સ, માર્સ્ક, ગાઉન તથા જૂતા પહેરે.
- 3.** કર્મચારીઓ અને અન્ય આગાંતુકો દ્વારા સાબુ અને પાણી વડે કે સેનિટાઇડરથી પોતાના હાથને વારંવાર સાફ કરવા આગ્રહ રાખો. એ દ્યાન રાખો કે હેન્ડ સેનિટાઇડર દરવાજા ઉપર, તમામ સ્પર્શ થતી જગ્યાઓ ઉપર, શૌચાલય અને જાહેર જગ્યાએ, સરળતાથી ઉપલબ્ધ જગ્યાઓ ઉપર મુકવામાં આવેલ હોય, અને તે નિયમિત રીતે રીકિલ કરાવતા રહેવા જોઈએ. તમામ કર્મચારીએ કામની પાળી અગાઉ અને પછી, કામના વચ્ચે સમય પહેલાં અને પછી, નાક સાફ કર્યા પછી, શૌચ, ઉધરસ કે છીંક આવ્યા પછી ભોજન કરતાં કે ભોજન તૈયાર કરતા અગાઉ અને માર્સ્ક લગાવતા, અકક્યા કે હટાવ્યા બાદ પોતાના હાથ સાફ કરવા જોઈએ. હાથની સ્વરચ્છતાને પ્રોત્સાહિત કરતાં પોસ્ટર લગાવો.



- 4.** લોકોને દરવાજા, સીડીઓની દિવાલો, અન્ય દિવાલો, દરવાજાના હેન્ડલ-જેવી સામાન્ય સપાટીઓને પોતાના હાથ વડે અડકવાથી દૂર રાખવા પ્રયત્ન કરો તથા દરવાજો ખોલવા માટે તેમને પોતાની કોણી, ખખા કે બાંધુનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપો. લાલ રંગમાં નવીન સંદેશો અને યોગ્ય જગ્યાઓએ મુકવામાં આવેલ સંકેતોને આ હેતુ માટે રાખવા જોઈએ. શક્ય હોય ત્યાં દરવાજાના હેન્ડલ અને નોબ્સ હટાવી દેવા. દરવાજો ખોલવા અને લિફ્ટ સંચાલન માટે ગ્લોબ્સ પહેરેલ વ્યક્તિને રાખવા જોઈએ. ઓટોમેટિક દરવાજા અને નળ લગાવવા અંગે વિચારરણ કરવી.

- વર્તમાન પત્રો, મેગેઝિનો અને અન્ય કાગળની સામગ્રી દૂર કરી દો, જે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય સંપર્કમાં આવી શકે છે.
- કર્મચારીઓને પેન, ફોન, ટેબલ, કાર્યાલય, કમ્પ્યુટર કે અન્ય ચંત્રો અને સાધનો પરસ્પર વહેંચવાથી મનાઈ કરો.
- એક એવી જગ્યા કે એવી પ્રક્રિયા તૈયાર કરો, જેના ઢ્રારા કોઈપણ જાતના સંપર્ક વગર એક જ જગ્યાએ પાર્સલ તથા ટપાલ મોકલી શકાય. ડીલીવરી સંપર્ક-રહિત રાખો.



- પેચ પદાર્થો માટે બંધ બોટલનું પાણી અને ડિસ્પોઝિબલ કપનો ઉપયોગ કરો.
- કર્મચારીઓ પોતાના નાક, મૌંકે આંખોનો સ્પર્શ ના કરે, તેવી આદત પડે એના માટે શિક્ષિત કરો.
- છંટકાવ તથા ફોર્ગિંગની સામાન્યતઃ ભલામણ કરાતી નથી. વ્યક્તિઓ ઉપર ડિસઇન્ફેક્ટન્ટ્સનો છંટકાવ (જેમ કે ટનલ, કશ કે ઓરકામાં) નુકશાનકારક છે તથા કોઈપણ પરિસ્થિતિમાં તે સ્વીકાર્ય નથી.

### કામના સ્થળે સામાજિક અંતર: ભૌતિક અને કાર્યાત્મક ફેરફાર, સ્પર્શરહિત કાર્ય અને સ્પર્શરહિત સેવા

- જો આવશ્યક જણાય તો કાર્યરથળમાં પરિવર્તન કરી ટેબલો અને ડેસ્ક તેમજ અન્ય કાર્યક્ષેત્રો તથા અન્ય સ્થળોએ સુવિધા મુજબ 2 મીટરનું અંતર જાળવવું જોઈએ. વ્યક્તિગત કાર્ય સ્થળોની આસપાસની જગ્યાઓને દશ્ય સંકેતકો, જેવા કે બેરિકેડ ટેપ, ફલોર ટેપ, શાંકુ વગેરેના માદ્યમથી ચિહ્નિત કરવા જોઈએ, જેથી અન્ય કોઈના અતિક્રમણને મર્યાદિત કરી શકાય.
- ઓરકામાં લોકોની ભીડ ઓછી કરવી અને સામાન્ય સ્થળો, જેવાં કે પ્રવેશ / પ્રસ્થાન / લિફ્ટ્સ / પેન્ટ્રીઝ / કાફેટેરિયા / સીડીઓ તથા લોંબી વગેરે જગ્યાએ સામાજિક અંતર જાળવવું.
- સુનિશ્ચિત કરવામાં આવે કે પ્રત્યેક વ્યક્તિ એટલું સમજું લે કે એકબીજું સાથે હંમેશા ઓછામાં ઓછા 2 મીટરનું અંતર રાખવાનું છે. જ્યાં ભૌતિક અવરોધ શક્ય ન હોય, ત્યાં સંકેત, રંગાની નિશાનીઓ કે અન્ય દશ્ય સંકેતો, જેવા કે – ફર્શ ઉપર રંગીન ટેપનો ઉપયોગ કરવો, જે 2 મીટરના અંતરે રાખવામાં આવેલ હોય, જે એવું સૂચિત કરે કે અહીં ઊભા રહેવાનું છે. સામાજિક અંતર જાળવવા પ્રોત્સાહિત કરવા મૌખિક જાહેરાત, સાઇનેજ, દશ્ય સંકેતોનો ઉપયોગ કરો.
- સામાન્ય જગ્યાઓ, જેવા કે કેફેટેરિયા / ચેંજિંગ રૂમ અને લોકર રૂમ, વોંશરૂમ, વગેરેનો ઉપયોગ મર્યાદિત કરો.
- મનોરંજક પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવી.
- સ્પર્શ, હાથ ભિલાવવા અને ગળે મળવા / ભેટવાથી દૂર રહો.
- કર્મચારીઓની બિનજરુરી અવરજન બંધ કરાવો.





**8.** શક્ય હોય ત્યાં સેવાઓ દૂરસ્થ રીતે (ફોન, વીડિયો કે વેબ) વગેરેના માદ્યમથી પૂરી પાડવી જોઈએ. સંપર્કરહિત/રોકડરહિત ચુકવણી પદ્ધતિ ઉપયોગમાં લેવી. ઇલેક્ટ્રોનિક ચુકવણી ટર્મિનલ/કેડિટ કાર્ડ રીકરને કેશિયરથી દૂર ગોઠવો.

**9.** સામસામે થતી મીટિંગની જગ્યાએ વર્ચ્યુઅલ મીટિંગની વ્યવસ્થા કરવી. બિનજરુરી તમામ બેઠક રદ્દ કરો. ભીડ અને અન્ય સમારંભોથી દૂર રહો, જો જરુરી હોય તો, કર્મચારીઓને સાર્વજનિક ઘોષણા પદ્ધતિ દ્વારા સંબોધિત કરો. મીટિંગ અનિવાર્ય હોય ત્યારે લોકોની સંખ્યા ઓછામાં ઓછી રાખવી. બેઠકમાં ભાગ લેનારાઓને સલાહ આપવી કે બીમાર હોવ, તે સ્થિતિમાં મીટિંગમાં ભાગ ન લેવો. જો શક્ય હોય તો મીટિંગ ખુલ્લી જગ્યામાં રાખવી. માસ્ક, ટિશ્યુ પેપર, સેનિટાઇઝર પૂરા પાડવા અને સામાજિક અંતર તથા વારંવાર હાથ સેનિટાઇઝ કરતા રહેવાનું સુનિશ્ચિત કરો.

**10.** ફ્લેક્સિબલ કાર્યસ્થળો, જેવાં કે – ઘરેથી કામકાજ, ટેલિફોન દ્વારા કાર્ય તેમજ લચીલો (ફ્લેક્સીબલ) કામનો સમય જેમકે સ્ટેગક શીફ્ટ, દળ વિભાજન, વૈકલ્પિક કાર્ય દિવસ તેમજ વધારાની શીફ્ટ, વગેરેથી એક જ સમયે હાજર કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં લાભ થશે. આનાથી કર્મચારીઓ વર્ચ્યે ભૌતિક અંતર જળવાશે. ઉપરાંત કર્મચારીઓ તેમજ અન્યો વર્ચ્યે પણ ભૌતિક અંતરમાં વધારો થશે.



**11.** સમન્પય જગ્યાં જરુરી છે, તેવાં કાર્યો – જેમાં સામાજિક અંતર શક્ય ના હોય ત્યાં કર્મચારીઓની નાની–નાની ટીમ બનાવો તથા ટીમના સભ્યોને કાયમ રાખો. અલગ અલગ ટીમોના કર્મચારીઓ વર્ચ્યે ઓછામાં ઓછો સંપર્ક રાખો.

**12.** તમામ પ્રકારના દસ્તાવેજુ કામકાજ, જેવા કે – ચર્ચા, બિલ, સેવા કાર્ડ, ફાઈલિંગ, તાલીમ વગેરે ઓનલાઇન/કાગળરહિત કરો.



**13.** લિફ્ટના બદલે સીડીઓને પ્રાથમિકતા આપવી. લિફ્ટમાં વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત કરવી. લિફ્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિ એકબીજાથી ઓછામાં ઓછા ત્રાણ ફુટના અંતરે સ્પષ્ટ રીતે નિર્દિષ્ટ જગ્યાએ દિવાલ તરફ મહોં કરીને ઊભા રહે. તમામ લિફ્ટ દિવસમાં બે વખત સેનિટાઇઝ કરવી.

**14.** પૂરવઠો તથા સામાન સ્વીકાર અને રવાના કરવાની કિયા અંતરિયાળ તથા રજાના કલાકોમાં કરવી જોઈએ. આ કાર્યમાં જોડાયેલ કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ તથા સામાન ભરવા/ઉતારવા માટે સુરક્ષા પ્રોટોકોલ રાખો, જેથી સામાજિક અંતર જળવી શકાય. તમામ સમાવિષ્ટ લોકોએ માસ્ક પહેરવું જોઈએ તેમજ સામાન ભરવા/ઉતારવા અગાઉ અને પછી હાથ ધોવા જોઈએ. પોતાના પરિસરમાં બહારના કોઈપણ શ્રમિકના પ્રવેશને ઓછો કરવો જોઈએ. શક્ય હોય તો વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલાં તેને વિસંક્રમિત કરો. સામાન ભરતા અગાઉ અને ઉતાર્યા પછી ટ્રકને સેનિટાઇઝ કરો.

## ચાત્રા સલાહ: અતિઆવશ્યક ચાત્રા; ચાત્રા દરમિયાન સંક્રમણ રોકવાના મૂળભૂત ઉપાય

- બિનજરુરી ચાત્રા ટાળો.
- એવા કર્મચારી, જેમને ગંભીર બીમારી છે, તેમને ચાત્રાની મંજુરી ન આપો.
- કોઈ કર્મચારી બહાર જાય ત્યારે તેને સેનિટાઇઝરની એક નાની બોટલ આપો. એ વાતની ખાતરી કરો કે તેણે માસ્ક પહેરેલ હોય અને જરુરી તમામ સંક્રમણ નિયંત્રણ ઉપાય પણ કરેલ હોય તથા આમતેમ ફરવા તથા જેટલું શક્ય હોય તેટલું સપાઠીઓને સ્પર્શ કરવાથી દૂર રહે તેમજ ભીડભાડવાળા સ્થળોએ ન જાય.
- સુનિશ્ચિત કરો કે જે કર્મચારી મુસાફરી કરતી વખતે અથવા અસ્થાયી કાર્ય વખતે બીમાર થઈ જાય છે, તેણે પોતાના સુપરવાઇઝરને જાણ કરવી જોઈએ તથા જરુર જાણાય તો સલાહ માટે તાત્કાલિક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડનારનો સંપર્ક કરવો.

## કેફેટેરિયા: સામાજિક અંતર અને સ્વચ્છતા ઉપાય

- આદર્શ રીતે કેફેટેરિયા બંધ જ રાખવા જોઈએ તથા પેક કરેલું ભોજન આપવું જોઈએ અથવા કર્મચારીઓને જાતે પોતાનું ભોજન લાવવા અને પોતાની જ જગ્યાએ ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
- જો આ શક્ય ન હોય તો સેલ્ફ સર્વિસ બંધ કરી દો.
- શક્ય હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ વાસણો તથા સામાનનો ઉપયોગ કરો. જો વાસણાને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો કર્મચારીઓને જણાવો કે પોતાના વાસણ સ્વચ્છ ધૂએ.
- ભોજન સમયે કર્મચારીઓ તથા ટેબલ વચ્ચે અંતર જાળવો.
- સામૂહિક ભોજન કરવા તથા ભોજન અને વાસણો પરસ્પર વહેંચવા ઉપર પ્રતિબંધ રાખો.
- કેફેટેરિયા ભોજન સંચાલકે પોતાના હાથ વારંવાર સેનિટાઇઝ કરવા જોઈએ તથા માસ્ક પહેરેલો રાખવો જોઈએ.
- જમવાનું સ્થળ સ્વચ્છ રાખો તથા દરરોજ ઓછામાં ઓછું બે વખત સેનિટાઇઝ કરો.



## કામદારોનો નિવાસ અને પરિવહન: નજીક નિવાસ; સુરક્ષિત પરિવહન

- શક્ય હોય ત્યાં સુધી, શ્રમિકોની કારખાનાના પરિસર અથવા નજીકમાં રહેવાની વ્યવસ્થા કરો.



- શક્ય હોય તો ઘરેથી કામકાજના સ્થળ સુધી કર્મચારીઓના પરિવહનની વ્યવસ્થા કરો.
- ડ્રાઇવરોએ માસ્ક પહેરવું જોઈએ તથા તેમના લક્ષણોની તપાસ કરવી જોઈએ.
- વાહનોમાં સામાજિક અંતરના નિયમોનું પાલન થવું જોઈએ.

- શ્રમિકોને સામાજિક પરિવહનથી બચવા તथા પગપાળા કે સાઇકલથી કામકાજના સ્થળે આવવા પ્રોત્સાહિત કરો.
- શ્રમિકોને શિક્ષિત કરો કે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતી વખતે માસ્ક પહેરે તથા વાહનમાં બેસ્તા અગાઉ અને ઉત્તરીને હાથ સેનિટાઇઝ કરો.
- કારપુલ તથા ફ્રાઇંપરનો ઉપયોગ ટાળો. શ્રમિકોને રીસેસ દરમિયાન બહાર ન જવા સલાહ આપો.

### માનવ સંસાધન: ઉદાર નીતિ, કામદારોની સુરક્ષા અને જાગૃતતાને સર્વોચ્ચ અગ્રીમતા

- તમામ માટે સુરક્ષાના પ્રયત્નોને ઉજાગર કરવા માનવ સંસાધન નીતિઓમાં ફેરફાર કરો. તમામ માટે સ્વાસ્થ્ય સુવિધા રાખો, પછી ભલે તે કર્મચારી રાજ્ય વીમા યોજના સુવિધા હોય કે ખાનગી મેડિકલેમ પૉલિસી.
- નજીકના ચિકિત્સક કે હોસ્પિટલ સાથે ટાઈ-અપ રાખો.
- કોવિડ-19 સંદર્ભે એક ખાસ રજા અંગેની નીતિ બનાવો.
- શક્ય હોય ત્યાં કર્મચારીઓના વ્યવહારનું નિરીક્ષણ કરવા કાર્યક્ષેત્ર અને અન્ય જગ્યાઓમાં સીસીટીવી કેમેરા મુકાવો. જેઓ શિથીલ કે બેજવાબદાર છે, તેમની તપાસ કરો. ચેતવણી આપવા છતાં કોઈપણ કર્મચારી ઢ્રારા સામાજિક અંતર તથા સ્વાસ્થ્ય કે સ્વચ્છતા અંગેની ટેવોનું વારંવાર પાલન ન કરનારને તેમના વાર્ષિક મૂલ્યાંકનમાં ઉજાગર કરો.
- કર્મચારીઓને કોવિડ-19 લક્ષણા, જોખમી કારકો અને સુરક્ષા સંદર્ભિત વ્યવહારો અંગે અધતન માહિતી અને તાલીમ આપો. તાલીમ સામગ્રી સમજવામાં સરળ હોવી જોઈએ તથા સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ હોવી જોઈએ. કોવિડ-19 સંબંધિત માહિતીના પ્રચાર-પ્રસાર માટે પોસ્ટર, વાર્તાલાપ, રજૂઆત અને ડ્રશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી શકાય. સાર્વજનિક ઘોષણા ઉપકરણોના માધ્યમથી નિયમિત અભ્યાસ તથા પરસ્પર સંવાદયુક્ત તાલીમ સત્ર ઢ્રારા તેમને સતત માહિતી આપતા રહો. સરકારી સહાયતા કેન્દ્રનો નંબર અને નજીકના સરકારી/ખાનગી ક્લિનિક/હોસ્પિટલોના સરનામા અને સંપર્ક નંબર કિસ્પલે કરો.
- કોવિડ-19 અનેક ચિંતાઓ સાથે સંકળાયેલ છે, જેમકે-બીમાર પડવા અને મૃત્યુનો કર, સામાજિક રીતે અળગા થવા રોજગાર ગુમાવી દેવાની ચિંતા, ઘરેલુ મુદ્દાઓ કે એકલતા વિયોગ દર્શય-શ્રાવ્ય તથા સોશિયલ મીડિયા મહત્વમાં સંભાવ્ય ડિપ્રેશનનો પ્રસાર કરે છે. એટલે ચિંતા અને ડીપ્રેશન સામાન્ય છે. તમામ શ્રમિકોને મનોસામાજિક/સાચકોલોજિક સહાયતા ઉપલબ્ધ કરાવવી જોઈએ. એક ઉદાર વાતચીતભર્યું તેમજ કરુણાસભર નેતૃત્વ સંસ્કૃતિ તૈયાર કરવી તથા જરૂર હોય ત્યાં ચિકિત્સા સારસંભાળ સુવિધા પૂરી પાડવી. શ્રમિકોને આગ્રહ કરવો કે તેઓ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરે.
- તમામ કર્મચારીઓ દિવસ દરમિયાન, જે પણ કામદાર કે વ્યક્તિ (મહિલા/પુરુષ) ને મળે, તેની એક સંપર્ક સૂચિ તૈયાર કરવા જગ્યાવવું તથા દિવસ પૂર્ણ થતાં તે સૂચિ સુપરવાઈઝરને સોંપવા જગ્યાવવું. આમ કરવાથી બીમારીના સંજોગોમાં થયેલા સંપર્કની માહિતી મેળવવી સરળ બની રહેશે.

**8.** ગંભીર કોવિડ-19 ના સૌથી વધુ જોખમ ધરાવતા શ્રમિકો (ઉપર કોવિડ-19 ના વિશે સંદર્ભ લેવો), ગર્ભવતી માતાઓ તथા નાના બાળકોની માતાઓની ચાદી તૈયાર કરો. સુનિશ્ચિત કરો કે તેઓ તમામ સાવધાનીઓનું પાલન કરી રહ્યા છે. તેમની ઉપર ખાસ ધ્યાન આપો. શક્ય હોય ત્યાં તેમને સુવિધાપૂર્ણ કામનો વિકલ્પ પૂરો પાડવો. તેમના માટે પ્રક્રિયાઓ અને ફરજોને એ રીતે તૈયાર કરો કે તેઓ લોકોના સંપર્કમાં આવવાથી દૂર રહે. તેમની હાજરી સંદર્ભે વિશેષ રૂપમાં ઉદાર રહેવું.



**9.** કાર્યસ્થળ ઉપર ગુટખા, તંબાકુ, પાન-મસાલા તથા સિગરેટનો ઉપયોગ પ્રતિબંધિત કરાવો. થુંકવા ઉપર પણ પ્રતિબંધ મૂકો, કેમકે આનાથી બીમારી ફેલાઈ શકે છે. સિગરેટ પીવા માટે પડાતો વિરામ/બ્રેક બંધ કરો, કારણ કે આમ કરવાથી તેઓ સામાજિક અંતરના નિયમોનો ભંગ કરે છે.

**10.** સમય સાથે આ બીમારીના વધુ પડતા મીડિયા કફરેજ અને ડૈનિક મૃત્યુની સંખ્યા દર્શાવવાથી લોકોમાં સંક્રમણ થવા અંગે અને તેનાં પરિણામો અંગે એક જાતનો ભય પ્રસરી ગયો છે. પરિણામે કોવિડ-19 સંક્રમિત લોકોને સમાજમાં તિરસ્કાર સાંપડી રહ્યો છે. તમામ શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમોને ખાસ કરીને આ દર્દીઓની સહાનુભૂતિ સાથે સારવાર કરવાની જરૂર અને જ્યાં સંભવ હોય ત્યાં સમાજમાં તેમની મદદ ઉપર ભાર મૂકવો જોઈએ.

**11.** મહામારી દરમિયાન સમયની સાથે, લોકો દ્વારા સ્થિતિને ઓછી ખતરનાક માનવાની વૃત્તિ જણાય છે. સતત તાલીમ કાર્યક્રમો દ્વારા તેની વિરુદ્ધ સંક્રમણ નિયંત્રણનો સેંટર અચૂક આપો.

**12.** આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત બનાવો.

**13.** કામદારો, સુપરવાઈઝરો અને વ્યવસ્થાપકો વચ્ચે સંપર્કને ટેલિફોન અને ઇન્ટરનેટ એપ્લિકેશનના માધ્યમથી સરળ બનાવો. આ જ રીતે, બીમારીની સૂચના આપવા અને કામદારોના સંપર્ક તથા બંધ હોવાની સૂચના માટે પણ આનો ઉપયોગ થઈશકે છે.

An app that speaks your language


Available in 11 different languages

Scan to Download

**Aarogya Setu**

App for iOS and Android

## વ्यक्तिगत सुरक्षात्मक उपकरण (पी.पी.ઇ.)




सार्स-कोरोना वायरस-2 ना संक्रमणाथी जोखम ओछुं करवामां एनिजनियरींग अने वहीवटी नियंत्रण वधु असरकारक मनाय છे, એ જ રીતે કोવિડ-19 ના કોરોના વિષાળુની અસર ઓછી કરવामાં વ्यક्तिगત સुરક्षात्मક ઉપકરणની પણ જરૂર પડી શકે છે, વ्यક्तिगત સુરક्षात्मક ઉપકરणનો સાચો ઉપયોગ, અમુક હદ સુધી જોખમ ઓછું કરી શકે છે. પરંતુ તેને ઉપરોક્ત અન્ય સુરક्षात्मક રણનીતિઓનો વિકલ્પ માની લેવો ન જોઈએ. કર્મચારીઓને પોતાના કાર્ય દરમિયાન સુરક્ષિત રાખવા માટે વ्यક्तिगત સુરક्षात्मક ઉપકરણ (પી.પી.ઇ.) પૂરા પાડવા, તે નિયોજકની જવાબદારી છે. ગ્લોવ્સ, ચશ્મા, ગાઉન (પહેરણ), સર્જિકલ ત્રણા પડ ધરાવતા માસ્ક અને એન-95, એફએફપી-2, કે.એન.95 જેવા શ્વસન સુરક્ષાત્મક માસ્ક, વગેરે વ्यક्तिगત સુરક्षાત્મક ઉપકરણ (પી.પી.ઇ.) ના ઉદાહરણ છે. માન્ય વ्यક्तिगત સુરક્ષાત્મક ઉપકરણ (પી.પી.ઇ.) સંદર્ભે અધતન વિવરણની જાળાકારી માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, ઘ એસોસિએટેડ ચેમ્બર્સ ઔફ કોમર્સ ઔફ ઇન્ડિયા, ફિક્ઝી, ભારતીય ઉદ્યોગ પરિસંઘ, પીએચીસીસીઆઈઅને નાસકોમ વગેરેની વેબસાઇટ જોતાં રહો. તમામ પ્રકારના વ्यક्तિગત સુરક્ષાત્મક ઉપકરણ (પી.પી.ઇ.) :

- (ક) મજુરોના જોખમના આધારે નક્કી કરવા જોઈએ
- (ખ) વ્યવસ્થિત પહેરવા
- (ગ) નિયમિત રીતે તપાસ થાય, વ્યવસ્થિત જાળવણી થાય તથા જરૂર પડ્યે બદલી નાખવા
- (ધ) બિમારીના પ્રસારને રોકવા વ્યવસ્થિત રીતે પહેરવા ઉતારવા, સાફ કરવા તથા નિર્દેશાનુસાર તેમને સંરક્ષિત કરાય / ફેંકાય.

વિવિધ પ્રકારના વ्यક्तિગત સુરક્ષાત્મક ઉપકરણ (પી.પી.ઇ.)ની જરૂરિયાત, કોઈ ખાસ પ્રકારના કામને પૂર્ણ કરવા દરમિયાન સંક્રમણના સંભવિત જોખમ તથા એવા કામ, જે સંપર્કને વધારે છે – તેના આધારે નક્કી થશે.

# જોખમની આકારણી

વિધાણું સામે અસરકારક રીતે લડત આપવા કાર્યસ્થળ પ્રીમાઇસીસની જોખમ આકારણી



કર્મચારીઓના મજૂરી સાથે નિયોજક અને પ્રબંધક દ્વારા કાર્યક્ષેત્ર ઉપર કોવિડ-19 થી થનાર સંકમણા સંબંધિત જોખમોની નિયમિત અધતન આકારણી થતી રહેવી જોઈએ અને સંકમણાના જોખમના આધારે કર્મચારીઓનું વગ્ફિકરણ કરવું જોઈએ.

**સંકમણાનું ઓછામાં ઓછું જોખમ:** એવાં કાર્યો, જેમાં સહકર્મચારીઓ, ગ્રાહકો, કોન્ટ્રાક્ટરો, સપ્લાયરો અને સામાન્ય નાગરિકો, વગેરેના સીધા સંપર્કમાં આવવાની શક્યતા ન હોય, તેમાં સંકમણાનું જોખમ ઓછું રહે છે. દાખલા તરીકે, દૂર રહેલ કર્મચારી (એટલેકે ઘરેથી કાર્ય કરનારા) તથા ટેલિફોન સુવિધા પૂરી પાડનાર કર્મચારીને તેઓ જેમનાં કાર્યમાં લઘુતમ સંપર્કની જરૂર પડે છે.

**સંકમણાનું મધ્યમ જોખમ:** જોખમનું આ સ્તર એવા કર્મચારીઓમાં હોય છે, જેમાં કામ કરતી વખતે સહકર્મચારીઓ, ગ્રાહકો, કોન્ટ્રાક્ટરો, સપ્લાયરો અને સામાન્ય નાગરિકો, વગેરેના સીધા સંપર્કમાં આવવાની આવશ્યકતા પડે અથવા તો જ્યાં કાર્યક્ષેત્રમાં લઘુતમ 2 મીટરનું સામાજિક અંતર જાળવી રાખવું શક્ય ન હોય, આમાં બજાર, બસ-સ્ટેન્ડ, સાર્વજનિક પરિવહન, શાળા-કોલેજ, નિર્માણ, હોટેલ અને રેસ્ટોરન્ટ, પોલીસ તેમજ સુરક્ષા વગેરે કામનો સમાવેશ થાય છે.

**સંકમણાનું મહત્તમ જોખમ:** એવાં કાર્યક્ષેત્ર, જ્યાં હાજર વ્યક્તિને કોવિડ-19 છે અથવા તો થઈ શકે છે તથા એવી જગ્યાઓ ઉપર સંભાવ્ય સંકમિત વસ્તુ કે સપાઠીના સંપર્કમાં આવનારને સંકમણાનું મહત્તમ જોખમ હોય છે. ઉદાહરણ તરીકે સ્વાસ્થ્ય કર્મચારી, લેબોરેટરીને શબ્દરમાં કામ કરનાર કર્મચારી કોવિડ-19 થી સંભાવ્ય સંકમિત વ્યક્તિઓને લઈ જનાર લોકો તથા એવા લોકોને સેવા પૂરી પાડનારા વ્યક્તિઓ, જેમ કે – ઘરધાટી, પર્સનલ ફ્રાઇંબર, ઘરવખરી પૂરી પાડનારા પલમ્બરો, સુથાર અને ઇલેક્ટ્રિશન વગેરે – જેઓ કોવિડ-19 સંકમિત વ્યક્તિઓના ઘરે સેવા પૂરી પાડતા હોય.

# જોખમ વ્યવસ્થા માટેના કાર્ય મુદ્દા

**સંક્રમણનું લધુતમ જોખમ:** સંક્રમણના જોખમની ઓછી સંભાવનાવાળા ક્ષેત્રોના કર્મચારીઓ માટે વધારાના વ્યક્તિગત સુરક્ષાત્મક સાધન (પીપીઇ)ની આવશ્યકતા નથી. આ કર્મચારીઓ માસ્કનો ઉપયોગ યથાવત જાળવી રાજે તથા સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાના મૂળભૂત દિશાનિર્દેશોનું પાલન ચાલુ રાખશે.

**સંક્રમણનું મધ્યમ જોખમ:** એવાં સ્થળ જ્યાં લધુતમ 2 મીટરનું શારીરિક અંતર પાલન શક્ય ન હોય, તેવાં સ્થળોના તમામ કામકાજ બંધ કરવા સંદર્ભે વિચારી શકાય. જો આ શક્ય ન હોય, તો આવા ક્ષેત્રમાં પ્રવેશ નિયંત્રિત કે પ્રતિબંધિત કરવો, કામકાજ વરચે થોડા સમયનું અંતર રાખી, મોંથી મોં અને ત્વચાની ત્વચાનો સંપર્ક લધુતમ કરવામાં આવે, કર્મચારીઓ એકબીજાને બાજુમાં કે એકબીજાની વિરુદ્ધ દિશામાં રહે, સમાન પાળીના કર્મચારીઓના સમૂહને એ જ સમૂહના કર્મચારીઓ સાથેનું કાર્ય સોંપો, છીંક પ્રતિરોધક ઉપાય સ્વરૂપે નિયમિત સંપર્ક ધરાવતી તમામ જરૂરીઓ ઉપર પારદર્શક કાચ/સ્વરચ્છ પ્લાસ્ટિકના અપરોધક લગાવો (જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં ફરીથી વાપરી શકાય તેવા માસ્કની વ્યવસ્થા કરો) તથા 60% ઇથાઈલ આલ્કોહોલથી આવી જરૂરીઓની નિયમિત સફાઈ કરવામાં આવે. બહારની હવા ખેંચીને અથવા એકની એક હવા ફરતી ના રહે, તે રીતે હવાની અપરજયપર કરતાં ચાંત્રિક સાધન ઢ્ણારા હવાની અપરજયપર વધારી શકાય. સતત હાથ ધોતાં રહેવા સાથે, આવા કર્મચારી માસ્કનો ઉપયોગ તથા પ્રાથમિક સંક્રમણ નિયંત્રણના તમામ ઉપાયો અમલમાં મૂકવાનું ચાલુ રાખશો. ખાસ કરીને મશીન રૂમ, વાહન, સાંકડી જરૂરીમાંથી બહાર નીકળતા પહેલાં તથા વ્યક્તિગત સુરક્ષાત્મક સાધન (પીપીઇ) પહેરતાં અગાઉ તેમજ ઉતાર્યા પછી, જોખમની આકારણી તેમજ સંસર્ગના પ્રકારના. આધારે સંક્રમણના સંભાવ્ય મધ્યમ જોખમ ધરાવતા કર્મચારીઓને જ્લોવ્સ, પહેરણા (ગાઉન), માસ્ક અને ચશ્મા સહિતના કેટલાંક સાધનોનો ઉપયોગ કરવો પડી શકે છે. સૂચવ્યા મુજબ વ્યક્તિગત સુરક્ષાત્મક સાધન (પીપીઇ) ના ઉપયોગ સંદર્ભે કર્મચારીઓને અવશ્ય તાલીમ આપવી જોઈએ.

સંક્રમણના સંભાવ્ય મધ્યમ જોખમ ધરાવતા કાર્યક્ષેત્રના તમામ રૂમ, શૌચાલયોમાં, એવી વસ્તુ અને સપાઠી જેનો નિયમિત ઉપયોગ થતો હોય, તેની દિવસમાં ઓછામાં ઓછા બે વાખત સફાઈ તથા જંતુમુક્તિ કરવામાં આવે. માસ્ક, ચશ્મા, જ્લોવ્સ અને કાર્યસ્થળ ઉપર પહેરવાના પોશાકના ઉપયોગ સંદર્ભે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી જોઈએ. શક્ય હોય તો કાર્યસ્થળ ઉપર પહેરવાના પોશાકને ત્યાં જ બદલવા અને ધોવડાવવાની વ્યવસ્થા કરવી.

**સંક્રમણનું સંભાવ્ય મહત્વમ જોખમ:** આમાં કર્મચારીઓના એક ખાસ વર્ગનો સમાવેશ થાય છે, જેઓ – હોસ્પિટલ, શબદર, લેબોરેટરી, એમ્બ્યુલન્સ તેમજ શબવાહિની વગેરેમાં કામ કરે છે. તેમને ઉપર જણાવ્યા મુજબ સામાન્ય માર્ગદર્શન તેમજ સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાનું પાલન યથાવત ચાલુ રાખવું જોઈએ. ઉપરાંત આવા કાર્યક્ષેત્રોમાં ખાસ એન્જિનિયરીંગ અને વહીવટી નિયંત્રણની આવશ્યકતા હોય છે તથા આવી જરૂરીમાં કાર્યરત લોકો ઢ્ણારા તેમના કાર્યસ્થળ અને કાર્યોના આધારે યોગ્ય એવા વ્યક્તિગત સુરક્ષાત્મક સાધન (પીપીઇ) નો ઉપયોગ ઇચ્છનીય છે. આવું માર્ગદર્શન આ દસ્તાવેજના સીમાની બહાર છે. આ બાબતોનું માર્ગદર્શન [mohfw.gov.in](http://mohfw.gov.in) ઉપર ઉપલબ્ધ છે. ઘરધાટી, વ્યક્તિગત વાહન અને ઘરેલું સામાન ઉપલબ્ધ કરાવનાર તથા પ્લાન્ટ અને ઇલેક્ટ્રિક્શન વગેરે – જેમને કોવિડ-19 સંક્રમિત લોકોના ઘરોમાં સેવા આપવી પડે છે, તેમને કામ દરમિયાન ત્રણ સ્તરનું (ત્રિસ્તરીય) સર્જિકલ માસ્ક/એન 95 શ્વસન રક્ષક, જ્લોવ્સ, માસ્ક/ચશ્મા કે પહેરણા (ગાઉન) (દર્દીની નજીકના સંપર્કના સમયગાળાને આધારે) પહેરવા તથા પ્રાથમિક સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

એવા કર્મચારી જેમને ગંભીર બીમારીનું જોખમ હોય, તેમણે મહત્વમ સંભાવ્ય જોખમવાળા કામ સોંપવાનું ટાળો.



# કાર્યસ્થળ ઉપર બીમારીની વ્યવસ્થા

નિયોજક/સુપરવાઈઝર/સહકર્મચારીઓએ કાર્યસ્થળ ઉપર કોવિડ-19ના લક્ષણો ધરાવતા શ્રમિકોની ત્વરિત ઓળખ કરી, તેમને અલગ કરી દેવા જોઈએ. જો તેમણે માસ્ક ન પહેર્યું હોય, તો તેમને ત્વરિત માસ્ક આપવું જોઈએ. લક્ષણ ધરાવતા કર્મચારી માટે એક આઇસોલેશન સુવિધા ધરાવતા બંધ થઈશકતા દરવાજા સાથે નાના, હવાઉઝાસ ધરાવતા ઓરડા બનાવી શકાય, જેથી તેમને અલગ કરી શકાય, જ્યાં સુધી તેમને તબીબી સારસંભાળ માટે મોકલવામાં ન આવે. અન્યથા કર્મચારીને તાત્કાલિક રીતે અન્યોથી દૂર એક ખુલ્લી જરૂરી મોકલી દેવા જોઈએ.

મોટાભાગના કિસ્સામાં, સુવિધા બંધ કરવાની જરૂર નથી. બીમાર વ્યક્તિ ઢારા લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાયેલ કોઈપણ ક્ષેત્રમાં લાગેલ બારીઓ અને દરવાજા ખોલી નાખ્યા પછી તે ક્ષેત્ર બંધ કરી દો. 24 કલાક થયા પછી સ્વચ્છ અને કીટાણુરહિત કરી દો.

- કીટાણુરહિત કરતા અગાઉ સાબુ અને પાણીથી ગંદી સપાટીઓ સાફ કરો.
- સપાટીઓ અને વસ્તુઓ માટે 1% વાળા સોડિયમ હાઇપોક્લોરાઇટ કે 60% વાળા ઇથાઈલ આલ્કોહોલ, જે પણ યોગ્ય હોય, સોલ્યુશનનો ઉપયોગ કરો.
- સાફસાઇટ કરતા કર્મચારીઓને માસ્ક, હાથમોજા, ચશ્મા/ફેસશીલ્ડ, ગાઉન અને જૂતાં અવશ્ય પહેરવા જોઈએ. ઓળખ કરોકે એવા કયા કર્મચારી છે, જે સંપર્કમાં આવેલ છે અને તેમને વધારે સાવધાની રાખવાની થઈશકે છે.
- કાર્યસ્થળમાં કોવિડ-19થી થનાર સંભવિત જોખમ વિશે કર્મચારીઓને જાણ કરો, પરંતુ ગુમતા જાળવી રાખો.
- એવા તમામ કર્મચારી, જેમણે ફેસ માસ્ક પહેર્યો નહોતો તેમજ લાંબા સમય સુધી/વારંવાર સંકભિત વ્યક્તિનો સંપર્ક/એટલે કે 2 મીટરની અંદર)માં આવ્યા હોય, તેમને 14 દિવસ માટે ઘરમાં કવોરેન્ટાઇન કરવા માટે જણાવો. શક્ય હોય તો ઘરેથી જ કાર્ય કરો, લક્ષણોનું જાતે જ દ્યાન રાખો, બીમારીનો રીપોર્ટ કરાવો અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર/રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરો.
- અન્ય કર્મચારીઓએ કામ ચાલું રાખવું અને કોઈપણ લક્ષણનું સૂક્ષ્મ રીતે દ્યાન રાખો અને રીપોર્ટ કરાવો.
- નિયોજકોની એ પણ જવાબદારી છેકે તે કામચલાઉ શ્રમિકોને કામ ઉપર પરત લેતા સયમે, એવી રીતે કામ કરાવે કે જેથી તે શ્રમિકો, તેમના સહકર્મચારીઓ અને સામાન્ય નાગરિકના સ્વાસ્થ્યનું રક્ષણ થાય.

કાર્યસ્થળ ઉપર કોવિડ-19 ના પ્રસારને રોકવા નિવારક ઉપાયો સંબંધિત સંપૂર્ણ વિગતો માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારની આદર્શ કામકાજની પ્રક્રિયા (SOP) જુઓ.



# नियोजको माटे नियम

## शुं करवुं



विविध कार्यस्थलो अने प्रक्रियाओनुं जोखम मूल्यांकन करो अने नियत कार्य माटे श्रमिकोने योञ्य पीपीईआपो.



घरना भोजन अने कामना स्थले भोजन माटे प्रोत्साहित करो.



परिसरमां अथवा जेटलुं नजुक शक्य होय तेटलुं श्रमिकोने आवास पूऱ्यापाठो.



संभव होय त्यां कर्मचारीओने सुरक्षित परिवहन पूऱ्यापाठो.



कार्यस्थले बीमारी सामे उपाय माटे एक योजना बनावो.



कोविड-19 माटे एक उदार रजानी नीति अपनावो. श्रमिकोनी सुरक्षा अने शिक्षण उपर भार मुक्तवा मानव संसाधन नीतिओमां सुधारा करो.



कार्यस्थले गेरहाजरी अटकावयुक्त सप्लाय चेईन अने मर्यादित के विलंबित वितरण अने सेवाओ वगेरेनो सामनो करवा एक भजबूत आक्रिमिक योजना तैयार करो.

# नियोजको माटे नियम

## शुं न करवुं



कोविड-19 लक्षणो धरावता कर्मचारीओने काम उपर न आववा दो. तेभने घरे जवा सूचना आपो अने तरत ज नजुकनी सरकारी सुविधानी सलाह लो.



भास्क वगर कोईने पाण पोताना परिसरमां प्रवेश आपो नहीं.



कर्मचारीओने संकेतो अने चिह्नो छारा सामान्य सपाठीओने स्पर्शवाथी रोकवा.



साधनोनी परउपर वहेँचाहीथी कर्मचारीओने रोको.



स्पर्शवा, हाथ भिलाववा अने गळे मळवा उपर प्रतिबंध मूळो.



जाहेर स्थलोअे श्रमिकोनी भीड थवा न दो.



श्रमिको छारा बिनजुरुरी अवरजवर उपर प्रतिबंध मूळो.



सामसामे बेसवाथी दूर रहो. मीटिंग माटे वर्चुअल प्लेटफोर्म वापरो.



शक्य होय त्यां सुधी ऐकन्डिशननो उपयोग न करो.

# नियोजको माटे नियम

## शुं करवुं



पोताना एकममां आवनाराओने भर्याइट करो.



तमाम कर्मचारीओ पोतानी पाणी माटे हाजर थाय त्यारे ज प्रवेशाळ्कार उपर तेमनामां ताव अने अन्य लक्षणो छेके नहि, तेनी तपास करो.



पोताना परिसरमां मास्कनो उपयोग फरजियात बनावो. श्वासोच्छ्वासना शिष्टाचार माटे कर्मचारीओने ज्ञान आपो.




सामाजिक अंतर जगवाई रहे, ते माटे शक्य होय त्यां कार्यस्थलने पुनः प्रस्थापित करो. अंतर जागवी राखवा विविध जग्याए पार्टीशन लगावो.



सामाजिक अंतर जागवी राखवा आंतरिक प्रक्रियाओ अने उत्पादन प्रवाहने बदलो. शक्य होय त्यां कर्मचारीओने फोन पूरो पाडवो.



रीमोट पद्धतिथी सेवाओ पूरी पाडवी अने मेजववी तेमજ संपर्करहित आपक-जापक डिलीवरी व्यवस्था राखो.



प्रत्येक समये परस्पर ओछामां ओछुं 2 मीटरनुं अंतर जगवाई रहे ते माटे श्रभिकोने प्रोत्साहित करो.



पोताना कर्मचारीओ वारंवार हाथ धुअे/हाथ सेनिटाइझ करे, ते बाबत उपर भार मूँझो.



कार्यस्थले एक्झोस्ट फैन सुविधामां वधारो करो.

# नियोजको माटे नियम

## शुं न कर्वुं



कर्मचारीओने खराब हवा—उजासवाणा ओरकाओमां काम करवानी अनुमति न आपो.



जो ज़ुरी न होय तो मुसाफरीने टालो. ज़ुर ज़णाय त्यारे तमाम पाचानी संक्षमणा नियंत्रण सावधानीओनुं पालन करो.



गंभीर बीमारी ना वधु जोखमवाणा श्रमिकोने मुसाफरीनी अनुमति न आपो.



शक्य होय तो कैफेटेरिया सेवा बंध करी दो.



श्रमिकोने एकसाथे जमवा बेसवानी मंजुरी न आपो.



पोताना कर्मचारीओने सार्वजनिक वाहनव्यवहारनो उपयोग करवाथी बचाववा.



कीटाणुनाशक्वाणा स्प्रेनो श्रमिको उपर उपयोग न करो.

# નિયોજકો અને કર્મચારીઓનો સામાજિક વ્યવહાર

નિયોજકો અને કર્મચારીઓના સામાજિક વ્યવહારના કાર્યસ્થળે કોવિડ-19 થવાના જોખમ ઉપર ભારે અસર પડે છે. એટલે નિયોજકો અને કર્મચારીઓ, બંનેએ જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે અને સમાજમાં હોય ત્યારે સામાજિક રીતે જવાબદારીભર્યા વ્યવહાર અંગે માહિતી પૂરી પાડવા નક્કર પ્રયત્ન કરવા જોઈએ. કાર્યસ્થળ ની સંકલ્પના એક એવું એકમ છે, જેનું સ્વાસ્થ્ય પ્રત્યેક વ્યક્તિના વ્યવહાર, તેમના સ્વાસ્થ્ય ઉપર આધારિત છે. એક સંકબિત વ્યક્તિ બીમારીને બીજામાં ફેલાવી શકે છે, જેનાથી માત્ર કંપનીના કામકાજ ઉપર જ નહિ, પરંતુ સંકબિત વ્યક્તિનો પરિવાર પણ પ્રભાવિત થાય છે. નીચેની બાબતો પર ભાર મુકાવો જોઈએ:

## શું કરવું



કાર્યસ્થળેથી ઘરે આવીને તરત જ પોતાના હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધૂઓ. પછી પોતાના કપડાં બદલી નાખો અને તે ધોઈ નાખો, એના પછી સ્નાન કરી લો.




જો તમારે પોતાના ઘરેથી બહાર જવું હોય, પછી ભલે તે થોડી વાર માટે કેમ ન હોય તો પણ પોતાના નાક અને મૌં ને ઢંકાય એવો માસ્ક હંમેશા પહેરી રાખો. માસ્કના આગળના ભાગને સ્પર્શ ન કરો કે તેને પોતાની હડપચીની નીચે સરકવા ન દેશો. ઢાંકણવાળી કચરાપેટીમાં ડિસ્પોઝેબલ માસ્કને ફેંકો.



બજારમાં જેટલું શક્ય હોય તેટલું ઓછું જાઓ. તમારી પાસે ખરીદીની એક લાંબી ચાદી તૈયાર થવા દો. બીજાનાથી સામાજિક અંતર જાળવો. બની શકે તેટલું ફોન વડેકે ઓનલાઈન ખરીદી કરો; અને સામાન ઘરે જ મંગાવો.



જો આપ કાપડના માસ્કનો ઉપયોગ કરતા હોવ, તો તેને દરરોજ સાબુ અને પાણીથી ધૂઓ.



જો તમે લોકોની સાથે હોવ, તો અન્યોથી ઓછામાં ઓછું 2 મીટરનું અંતર જાળવો.




શ્વાસોચ્છ્વાસના શિષ્ટાચારનું પાલન કરો.

# નિયોજકો અને કર્મચારીઓનો સામાજિક વ્યવહાર

## શું કરવું



એક વખતમાં ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી વારંવાર (ઓછામાં ઓછું દર બે કલાકે) હાથ ધોવાની ટેવ પાડો. ભલે હાથ સ્વચ્છ જગાય છતાં હાથ ધૂઓ. રસોઈ કરતા પહેલાં કે જમ્યા પણી, શૌચાલયનો ઉપયોગ કરીને, નાક સાફ કરીને, ખાંસીકે છીંક આવ્યા પણી હાથ ધૂઓ.



પોતાના ઘરે અને જિસસામાં રાખવા આલ્કોહોલયુક્ત હેન્ડ સેનિટાઇઝરની બોટલ ખરીદો.



ઘરમાં સામાન્યતઃ જ્યાં વારંવાર સ્પર્શ થતો હોય, તેવી સપાટીઓને પોતાના કીટાળુનાશકથી સાફ કરો.



પોતાના મોબાઇલ ફોનને આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરથી લૂછો.



કદ્દ કદ્દ સપાટીઓને આપ સ્પર્શી રહ્યા છો તેમજ કેટલી વખત આપના ચહેરાનો સ્પર્શ કરો છો, તે દ્યાનમાં રાખો. હાથનો સ્પર્શ ચહેરા ઉપર ન થાય તેવીટેવ પાડો.



ઘરમાં બનેલું તાજું ગરમ ભોજન, જમીને ચોંચ પોષણયુક્ત ભોજન લેવાનું સુનિશ્ચિત કરો અને પોતાને સારી રીતે હાઇફ્રોટેક રાખો.



શાકભાજુ રાંધતા અગાઉ સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈનાખો.



ઘરે નિયમિત કસરત કરો.

# નિયોજકો અને કર્મચારીઓનો સામાજિક વ્યવહાર

## શું કરવું



ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખવું, કેમકે તેમને ગંભીર બીમારી થવાનું જોખમ વધુછે.



જો આપને કોવિડ-19 ના લક્ષણો જણાય, તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરો અને તબીબી સલાહને અનુસરો. આપના લક્ષણોને આવગાળવા નહીં. માસ્ક પહેરો અને સ્વયંને ત્યાં સુધી અલગ રાખો, જ્યાં સુધી આપટેસ્ટ ન કરાવી લો. જાતે ઉપચાર ન કરશો.

જો આપના પરિવારમાં કોઈને પણ કોવિડ-19 ના લક્ષણ જણાય, તો તરત તબીબી સહાય મેળવો. તે વ્યક્તિને માસ્ક આપો અને તેમને ત્યાં સુધી અલગ રાખો, જ્યાં સુધી તેમને કોવિડ-19 નથી એવી ખાતરી ન થાય.

## શું ન કરવું



પોતાના હથેળીમાં કે ચહેરો ઢાંક્યા વિના ખાંસી કે છીંક ન ખાવ.



જો ખૂબ જ આવશ્યક ન હોય તો જ ઘરની બહાર જવાનું ટાળો. પરિવારના સભ્યોને પણ આ સૂચનાનું પાલન કરાવો.



હોસ્પિટલ જવાથી દૂર રહો. આપના ડૉક્ટરની ફોનથી જ સલાહ મેળવો. વૈકલ્પિક સર્જરીને પછી માટે ટાળવી.



માસ્ક ન પહેરનારાઓથી દૂર રહો.

# નિયોજકો અને કર્મચારીઓનો સામાજિક વ્યવહાર

## શું ન કરવું



શક્ય હોય ત્યાં સુધી ડ્રાંગ પણ મુસાફરી ન કરો. યાત્રા કરવાથી આપને કોવિડ-19 થવાના જોખમની સંભાવના વધી જાય છે.



સાવજનિક વાહનવ્યવહાર ન કરો, પગપાળા કે સાયકલનો ઉપયોગ કરો. તે આપના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.



લગ્ન, જન્મદિવસ વગેરે જેવા મોટા સામાજિક પ્રસંગોમાં જવાનું ટાળો. પ્રસંગોમાં ભાગ લેવા અને સગાસંબંધી સાથે વાત કરવા વીડિયો કોલ કે ટેલિફોનનો ઉપયોગ કરો. જો આ કાર્ય એકદમ અનિવાર્ય હોય તો માર્ક પહેરો અને સતત સામાજિક અંતર જાળવી રાખો. શક્ય એટલો ઓછો સમય રોકાવ.



બહારનું જમવાનું ટાળો.



લોકો સાથે સમૂહમાં જમવાથી બચો. કેમકે આનાથી કોવિડ-19 થવાનું જોખમ છે.



ભીડભાડવાળી જગ્યાઓ, જેવીકે – મૉલ, રેસ્ટોરન્ટ, વ્યાચામશાળા, ધાર્મિક સ્થળ અને રમતગમતના મેદાનો વગેરેથી દૂર રહો.



સામાન્ય રીતે લોકો દ્વારા મોટાભાગે ઘરથી સપાટીઓને અડશો નહીં. જેમકે – સીડીઓની રેલીંગ, દરવાજાના હેન્ડલ અને નોંબ, વીજળીની સ્થિર, દુકાન કાઉન્ટરની સપાટી, નળ વગેરે. દરવાજો ખોલવા પોતાની કોણી કે બાહુનો ઉપયોગ કરો.



લોકોને પોતાના ઘરે આમંત્રાણ આપવાથી બચો. તેમજ લોકોને મળવાનું પણ ટાળો.

# નિયોજકો અને કર્મચારીઓનો સામાજિક વ્યવહાર

## શું ન કરવું



હાથ મિલાવવા, ગળે મળવા કે પોતાના ઝોહીજનોને ચુંબન કરવાનું ટાળો.



કોઈની સાથે પોતાનો મોબાઇલ ફોન કે કંઈપણ વસ્તુની આપ-લે ન કરો.



જો આપને તાવ હોય, ગળામાં ખારાશ અને / અથવા ખાંસી થઈ હોય તો કોઈની નજીક ન જાવ.



ખાસ કરીને કોઈંશંકાસ્પદ વ્યક્તિ અથવા તો જેને કોવિડ-19 થયાનું નિદાન થયેલ હોય, તેમની નજીક ન જાઓ.



થૂંકો નહિ.



કોવિડ-19 સંકભિત દર્દીઓને અવગાળવા કે તેમની મદદ ન કરવા જેવો ખરાબ વ્યવહાર ન કરશો. ચાદ રાખો, તમે પણ કોવિડ-19 નો શિકાર બની શકો છો.

# આકર્ષિક યોજના

આપના કાર્યસ્થળ કે સમાજ, જ્યાં આપના કર્મચારીઓ નિવાસ કરતા હોય, ત્યાં કોવિડ-19 સંક્રમણ ફેલાવાની શક્યતા હોય, તો એક વેપાર નિરંતરતા યોજના વ્યાપાર અવિરતતા વિકસાવો. આ યોજનાને એ રીતે વિકસાવવી જોઈએ કે આપનો વ્યવસાય કઈ રીતે ચાલુ રાખવો. ભલે કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સપ્લાયરો વગેરેની એક મહત્વપૂર્ણ સંખ્યા આપના વ્યવસાયના સ્થળે આવી ન શકે. યોજના વિશે તેમની સાથે વાતચીત કરો અને ખાતરી કરો અને ખાતરી કરો કે તેઓ સમજે છે કે આ યોજના હેઠળ શું કરવાનું છે અને શું ના કરવું જોઈએ. કાર્યસ્થળથી દૂર રહેવાની અગત્યતા ઉપર પણ ભાર મૂકો. પછી ભલે તેમને સામાન્ય લક્ષણ હોય કે તેમણે સાધારણ દવા લીધી હોય (જેમકે- પેરાસીટામોલ, ઇબ્યુપ્રોફેન), જેના કારણે લક્ષણ ન જણાતા હોય

- જો જરૂરી હોય તો, પોતાના વ્યવસાયની રીત બદલવા તૈયાર રહો, જેથી મહત્વપૂર્ણ સંચાલન ચાલુ રહે
- વિક્ષેપિત સપ્લાય ચેઇન કે વિલંબિત ડિલીવરીથી બચવા યોજના બનાવો.
- મહત્વપૂર્ણ વસ્તુઓ અને સેવાઓ માટે વૈકલ્પિક સપ્લાયરોની ઓળખ કરો.
- ગ્રાહકોને યોજનાને પ્રાથમિકતા આપો તેમજ પોતાના કેટલાંક કાર્યો હંગામી ધોરણે રદ કરો અથવા ઓછાં કરો.
- સતત સંચાલન સંબંધિત કાર્યોની ઓળખ કરી તેને પ્રાથમિકતા આપો. કર્મચારીઓની સુરક્ષા અને સતત કામકાજ માટે કાર્યસ્થળે હાજર શ્રમિકોની સંખ્યામાં ઘટાડો કરો.
- શક્ય હોય ત્યાં સેવાઓનું વિતરણ દૂરથી જ કરો.
- જો આપને શ્રમિકોની ગેરહાજરી વધુ લાગતી હોય તો જરૂરી વ્યાવસાયિક કામકાજ કેવી રીતે ચાલુ રાખવા, તે માટે યોજના તૈયાર કરો.
- કાર્યસ્થળ અને રજાની નીતિઓ સંદર્ભે ઉદાર રહો.
- જરૂરી કાર્યો કરવા માટે કર્મચારીઓને અન્ય શાખાઓની પણ તાલીમ આપો.





**કર્મચારી રાજ્ય વીમા નિગમ**  
**Employees' State Insurance Corporation**

શ્રમ અને રોજગાર મંત્રાલય

[f www.facebook.com/labourministry](https://www.facebook.com/labourministry) [@labourministry](https://twitter.com/labourministry)

કર્મચારી રાજ્ય વીમા નિગમ

[f www.facebook.com/esichq](https://www.facebook.com/esichq) [@esichq](https://twitter.com/esichq)